

Seat No. : \_\_\_\_\_

**NR-105**  
**December-2015**  
**M.Com., Sem.-I**  
**403 : Marketing Management**

Time : 3 Hours]

[Max. Marks : 70]

- સ્વીચ્છા : (1) સ્પષ્ટ મુદ્દાસર જવાબ આપો.  
(2) પ્રશ્નપત્રમાં પ્રશ્નનો જે નંબર હોય, તે જવાબ લખતી વખતે લખો.  
(3) દરેક પ્રશ્નની સામે તેના ગુણ દર્શાવેલ છે.

1. (a) માર્કિંગ સંચાલનનો ખ્યાલ ચર્ચો. 7

અથવા

ભારતના સંદર્ભમાં માર્કિંગ ગોઠવણ સ્પષ્ટ કરો.

- (b) ટૂંકમાં જવાબ આપો : (ગમે તે બે)

4

- (1) માર્કિંગ યોજનાની વ્યાખ્યા આપો.  
(2) ગ્રાહક મૂલ્ય એટલે શું ?  
(3) માર્કિંગ લક્ષ્ય એટલે શું ?

- (c) ઓક કે બે લીટીમાં જવાબ આપો :

3

- (1) સ્થળ માર્કિંગ કરતા માર્કટરનું ઓક ઉદાહરણ આપો.  
(2) ગ્રાહક સંતોષ એટલે શું ?  
(3) ગ્રાહકોને જાળવવા એટલે શું ?

2. (a) બજાર વિભાજનના આધારો સમજાવો. 7

અથવા

ગ્રાહક વર્તણૂકની વ્યાખ્યા આપો અને ખરીદ નિર્ણય પ્રક્રિયા વર્ણવો.

- (b) ટૂંકમાં જવાબ લખો : (ગમે તે બે)

4

- (1) તમારા બજાર હરીફને તમે કઈ રીતે ઓળખશો ?  
(2) બજાર સ્થાન નિર્ધારણ એટલે શું ?  
(3) માર્કિંગ સંશોધન એટલે શું ?

(c) એક કે બે લીટીમાં જવાબ લખો :	3
(1) હરીજોનું વિશ્વેષણ એટલે શું ?	
(2) બજાર સંશોધનના હેતુઓ જણાવો.	
(3) સંશોધનમાં સમસ્યાનું સ્પષ્ટીકરણ એટલે શું ?	
3. (a) નવી પેદાશ વિકાસ એટલે શું ? તેની પ્રક્રિયા ચર્ચો.	7
<b>અથવા</b>	
નોંધ લખો : વિતરણ કરી સંચાલનના નિર્ણયો	
(b) ટૂકમાં જવાબ લખો : (ગમે તે બે)	4
(1) પેદાશ શ્રેણીનો અર્થ આપો.	
(2) માર્કેટિંગ માહિતીસંચાર મિશ્ર સ્પષ્ટ કરો.	
(3) પૂર્ણ કિમત નીતિ એટલે શું ?	
(c) એક કે બે લીટીમાં જવાબ લખો :	3
(1) પેદાશ પર નિશાની (બ્રાન્ડિંગ)ના પ્રકારો જણાવો.	
(2) કિમત વ્યૂહરચનાની વ્યાખ્યા આપો.	
(3) પેદાશ સ્વીકૃતિ પ્રક્રિયા એટલે શું ?	
4. (a) સેવાઓનું સ્વરૂપ સ્પષ્ટ કરો.	7
<b>અથવા</b>	
‘આંતરરાષ્ટ્રીય માર્કેટિંગ’ શબ્દની વ્યાખ્યા આપો અને તેની જરૂરિયાત વર્ણવો.	
(b) ટૂકમાં જવાબ લખો : (ગમે તે બે)	4
(1) વેચાણ પછીની સેવા વ્યૂહરચના એટલે શું ?	
(2) સીધુ મૂડી રોકાણ એટલે શું ?	
(3) બહુરાષ્ટ્રીય નિગમ (MNC)નો અર્થ જણાવો.	
(c) એક કે બે લીટીમાં જવાબ લખો :	3
(1) કોઈપણ એક સારા સુસ્થાપિત સંયુક્ત સાહસનું નામ આપો.	
(2) સેવાઓના પ્રકારો દર્શાવો.	
(3) પેદાશ સહાયક સેવાઓ એટલે શું ?	

5. સાચા જવાબની પસંદગી કરો :

14

- (1) \_\_\_\_\_ એ માર્કટિંગ પ્રયત્નોની દોરવણી & સંકલન કરતું કેન્દ્રીય સાધન છે.
 

(a) વ્યૂહાત્મક યોજના	(b) કોર્પોરેટ મિશન
(c) માર્કટિંગ યોજના	(d) કાર્યરીત યોજના
- (2) માહિતી સંશોધન અભ્યાસ માટે ખાસ પ્રથમવાર જે માહિતી/ડેટા મેળવવામાં આવે છે તેને \_\_\_\_\_ કહે છે.
 

(a) પ્રયોગાત્મક સંશોધન	(b) ગૌણ માહિતી
(c) પ્રાથમિક માહિતી	(d) નરમ સંશોધન
- (3) \_\_\_\_\_ માર્કટિંગમાં આંતરિક, સંયુક્ત, કામગીરી અને સંબંધોના માર્કટિંગનો સમાવેશ થાય છે.
 

(a) વેચાણ ઘ્યાલ	(b) પેદાશ ઘ્યાલ
(c) હોલેસ્ટીક માર્કટિંગ ઘ્યાલ	(d) સામાજિક માર્કટિંગ ઘ્યાલ
- (4) \_\_\_\_\_ એ બહુરાષ્ટ્રીય કંપની ભારતીય નથી.
 

(a) વિપ્રો	(b) રિલાયન્સ
(c) ઓશિયન પેર્સિન્ટ્સ	(d) હિન્ડુસ્તાન યુનિલિવર લિમિટેડ (HUL)
- (5) \_\_\_\_\_ એટલે પેદાશ પર કરવામાં આવતું કોઈપણ પ્રકારનું ચિલ્ન, સંજા, ચિત્ર, નંબર કે પેદાશનું નામ છે, જેથી પેદાશ ઓળખી શકાય છે.
 

(a) પેદાશ શ્રેણી	(b) માહિતીસંચાર
(c) બ્રાન્ડિંગ	(d) સંશોધન
- (6) યુનિવર્સિટીએ \_\_\_\_\_ માર્કટિંગનું પ્રતિનિધિત્વ કરે છે.
 

(a) અનુભવો	(b) સેવાઓ
(c) પેદાશો/માલ	(d) નિર્જયો
- (7) ગ્રાહકની \_\_\_\_\_ ને આર્થિક, સામાજિક, સંસ્કૃતિક અને વ્યક્તિગત પરિબળો અસર કરે છે.
 

(a) પેદાશો	(b) ગ્રાહક મૂલ્ય
(c) સહાયક સેવાઓ	(d) ખરીદ વર્તણૂક
- (8) એમ.એન.સી. (MNC) એટલે શું ?
 

(a) બહુરાષ્ટ્રીય સહકાર	(b) બહુરાષ્ટ્રીય કંપની
(c) બહુરાષ્ટ્રીય નિગમ	(d) બહુરાષ્ટ્રીય સહયોગ
- (9) \_\_\_\_\_ વિતરણ માર્ગમાં ઉત્પાદક સીધું છેલ્લા વપરાશકારને વેચાણ કરે છે.
 

(a) એક કક્ષા	(b) બે કક્ષા
(c) ત્રણ કક્ષા	(d) શૂન્ય કક્ષા

- (10) \_\_\_\_\_ એટલે ગ્રાહકો આ પેદાશોને પસંદ કરતા નથી અને તે માટે કિંમત ચુકવવાનું ટાળે છે.
- (a) ઘટતી માંગ (b) અનિયભિત માંગ  
(c) નકારાત્મક માંગ (d) પૂર્ણ માંગ
- (11) \_\_\_\_\_ એટલે માનવીય અને સામાજિક જરૂરિયાતોને ઓળખવી અને તે પૂર્ણ કરવી.
- (a) માર્કેટિંગ (b) ઘટના  
(c) અનુભવ (d) અનુકૂલન
- (12) \_\_\_\_\_ એ માનસિક તબક્કા છે, જે દ્વારા વ્યક્તિ નવપ્રવર્તનની વિગતો સંભવે છે અને છેલ્લે સ્વીકાર કરે છે.
- (a) મૂલ્ય સ્વીકૃતિ પ્રક્રિયા (b) ગ્રાહક સ્વીકૃતિ પ્રક્રિયા  
(c) ગ્રાહક સંતોષ (d) આમાંથી કોઈપણ નહીં
- (13) \_\_\_\_\_ એ માપી શકાય તેવું, વાસ્તવિક, ગણી શકાય, જુદું પાડી શકાય અને પગલાં ભરી શકાય તેવા હોવા જોઈએ.
- (a) બાજાર વિભાગો (b) ગ્રાહક વર્તણૂક  
(c) ખરીદ નિર્ણયો (d) બાજાર સંશોધન
- (14) \_\_\_\_\_ એ એક કરતા વધારે રાષ્ટ્રોમાં કામગીરી કરે છે અને શુદ્ધ રાષ્ટ્રીય હરીફાઈમાં ઉપલબ્ધ નથી, તેવા સંશોધન અને વિકાસ, ઉત્પાદન, ગણતરી, માર્કેટિંગ અને નાણાકીય લાભો મેળવે છે.
- (a) રાષ્ટ્રીય વ્યાપારી પેઢી (b) વિશ્વવ્યાપક વ્યાપારી પેઢી  
(c) સ્થાનિક વ્યાપારી પેઢી (d) આ વિકલ્યોમાંથી કોઈપણ નહીં

**Seat No. :** \_\_\_\_\_

**NR-105**  
**December-2015**  
**M.Com., Sem.-I**  
**403 : Marketing Management**

**Time : 3 Hours]**

**[Max. Marks : 70]**

- Instructions :**
- (1) Write answer to the point.
  - (2) Write in your answer-book the exact question No. mentioned in the question paper.
  - (3) Figures to the right hand side of the questions indicate marks.

1. (a) Discuss the concept of Marketing Management. 7

**OR**

Clarify marketing adjustments in Indian context.

- (b) Answer any **two** in short : 4
- (1) Define Marketing Plan.
  - (2) What is Consumer Value ?
  - (3) What is Marketing Task ?
- (c) Answer in **one** or **two** sentence. 3
- (1) Give one example of Place Marketers.
  - (2) What is Customer satisfaction ?
  - (3) What is Consumer retention ?

2. (a) Explain the bases of Market Segmentation. 7

**OR**

Define consumer behavior and describe buying decision process.

- (b) Answer any **two** in short : 4
- (1) How to identify Market Competitors ?
  - (2) What is Market Positioning ?
  - (3) What is Marketing Research ?

- (c) Answer in **one** or **two** sentence. 3
- (1) What is Analyzing Competitors ?
  - (2) Mention the objectives of Marketing Research.
  - (3) What is problem identification in Research ?
3. (a) What is new product development ? Discuss its process. 7
- OR**
- Write note on ‘Channel Management Decision’.
- (b) Answer any **two** in short : 4
- (1) Give the meaning of product line.
  - (2) Clarify the Marketing Communication Mix.
  - (3) What is Full Cost Pricing ?
- (c) Answer in **one** or **two** sentence. 3
- (1) Mention the types of branding.
  - (2) Define pricing strategies.
  - (3) What is consumer adoption process ?
4. (a) Clarify the nature of services. 7
- OR**
- Define the term – ‘International Marketing’ and explain its needs.
- (b) Answer any **two** in short : 4
- (1) What is After Sales Service Strategy ?
  - (2) What is Direct Investment ?
  - (3) Give the meaning of Multi-National Corporations (MNC).
- (c) Answer in **one** or **two** sentence. 3
- (1) Mention one name of well-established joint venture.
  - (2) State the types of services.
  - (3) What is product support services ?

**5. Select the right answer :**

14

